

પોલીસ અધિક્ષકની કચેરી, નવસારી.

નવસારી જીલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ સારી કામગીરીની વિગત
સાફલ્યગાથા તા.૧૭/૦૨/૨૦૨૦ થી ૨૩/૦૨/૨૦૨૦

વિક દરમિયાન કરેલ સારી કામગીરીની માસમાં નવસારી પોલીસે કરેલ સારી કામગીરી(સાફલ્યગાથા)ની વિગત.

અ.નં	સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી	કરેલ સારી કામગીરીની વિગત	રીકવર કરેલ મુદામાલ
------	--------------------------------------	--------------------------	--------------------

મહિલા સશક્તિકરણના ભાગરુપે ખેરાગમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રુમલા સ્કુલમાં સ્કુલની વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ તાલીમ.



1. જીલ્લા શહેર કક્ષાએ કોઈ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.

- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સંબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
- ગુમ/અપહરણ થયેલ બાળકોની ભારત સરકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ <http://trackthemissingchild.gov.in/missing/index.php> ઉપર રોજ રોજ એન્ટ્રી કરવામાં આવે છે.
- પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી રુરલ, જલારાપોર વિસ્તારમાં તાલીમ બંધ ડ્રાઇવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરૂ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
- ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહિલા સુરક્ષા સમિતીની મહિલાઓ તેમજ એન.જી.ઓ. યાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.

• ટ્રાફિક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

- ટ્રાફિક સપ્તાહની ઉવજણી કરવામાં આવી રહેલ છે. ટ્રાફિક અવેરનસ અંગે શાળા કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે
- ટ્રાફિક જનજાગૃતિ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફિકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનસ કાર્યક્રમો રાખવામાં આવેલ.
- વારંવાર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઇવ રાખી ટ્રાફિક અવેરનસ અંગેની સમજ આપવામાં આવે છે.

• ગુનાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?

- નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન નક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સાઇનબોર્ડ, લગાડવામાં આવેલ છે.
- દરેક પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગ ધ્વારા કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.
- નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમિયાન સેક્ટરવાઇઝ કોસ પેટ્રોલીંગ કરવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
- વારંવાર કોમ્પીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ઢાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
- કાઇમ ઇન્વેસ્ટીગેશન અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્વેસ્ટીગેશનમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

• અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરંતજ ધ્યાન પર આવે તેવી બાબતો.

- સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે